



નં.ડીપી/એનએ/૨૪-૬૭/૨૦૦૧-૨૦૦૨
જિલ્લા પંચાયત કચેરી, (મહેસુલ ગામ),
વલસાડ તારીખ ૨૪/૦૬/૨૦૦૨

(૧) અરજદારશ્રી કસનજી લલ્લુભાઈ દેસાઈ રહે. વાપી દમશરોડ તા. પારડી ની મોજે ચલા તા. પારડીના સ.નં ૨૮૧/૨ વાળી જમીનની રહેઠાણ મકાન બાંધકામની ખેતી સિવાયની કાયમી પરવાનગી માટેની તા:૧૮/૦૩/૨૦૦૨ ની અરજી.

(૨) જમીન મહેસુલ કાયદો ૧૮૭૯ ની કલમ - ૬૫.

(૩) જિલ્લા પંચાયત વલસાડની સામાન્ય સભાના ઠરાવ નં. ૧૫(૧૯) તા:૨૨/૧૨/૨૦૦૦ થી સુપ્રત થયેલ સત્તા.

(૪) આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી પારડીના શેરા કમોંક : તા. પં.સુ.નં. ઓ. ૨૪ - ૧૦ વર્ગી ૮૧૩/૨૦૦૧ - ૨૦૦૨ તારીખ : ૧૮/૦૩/૨૦૦૨ થી પૂરું થતું પકરણ.

(૫) ૭/૦૫/૨૦૦૨ ના રોજની જિલ્લા પંચાયત વલસાડ ની કારોબારી સમિતીની બેઠકમાં ઠરાવ નં. ૧૫૬ થી થયેલ નિર્ણય.

હુકમ :-

મોજે ચલા તાલુકા પારડીના સર્વે નંબર ૨૮૧/૧/૨ ની જમીનમાં પ્રકરણો સ.ઈ. તાલુકા પંચાયત પારડીએ ખાત્રી કરેલા તારીખ : ૨૮/૦૨/૨૦૦૨ ના નકશામાં લાલ લીટીથી બતાવેલ ચોરસ મીટર ૬૧૯૯૩-૦૦ જમીનમાં કાયમી ખેતી સિવાયનો પ્લોટ બનાવી તેમાં ગુલાબી કલરથી બતાવેલ ચો.મી. ૪૩૧૨-૦૦ જમીનમાં નકશામાં આપેલ વિગત મુજબના રહેઠાણ મકાનના બાંધકામ કરવાની જમીન મહેસુલ કાયદાની કલમ-૬૫(૧) અન્વયે કાયમી પરવાનગી શ્રી કસનજી લલ્લુભાઈ દેસાઈ રહે. વાપી દમશરોડ તા. પારડી ને આ કામે વિશેષધારો રૂ. ૩૭૧૯-૬૦ તથા લોકલફંડ, શિક્ષણ ઉપકર તેમજ બીજા કરો લઈ મીચેની શરતોનું પાલન કરવાની શરતે આપવામાં આવે છે. તા. ૦૫/૦૮/૧૯૮૮ના નવા દરે નક્કી થતો વિશેષધારો ગ્રામવર્ગ - ૨ ટેબલ બી માં પ્રકૃત હોવાથી ૦ - ૦૬ પૈસા દર ચો.મીટરે લેવા હુકમ કરવામાં આવે છે. તા. ૦૧/૦૮/૧૯૮૩ થી અમલમાં આવે તે રીતે ખેતીની જમીનને બીજા ખેતીમાં ફેરવવાનો રૂપાંતર કર આ જમીનને લાગુ પડે છે. ભરવાનો થતો રૂપાંતર કર રહેઠાણ મકાનના ખેતુ માટે દર ચોરસ મીટરે ૦-૬૦ પૈસા લેવાપાત્ર થાય છે. તે મુજબ રૂપાંતર કર રૂ. ૩૭૧૯૬/- પૂરા અરજદારે સરકારશ્રીમાં ચલન નં. ૮૦૪ તા. ૧૫/૦૫/૨૦૦૨ થી નીચેના હેડે ભરપાઈ કરેલ છે. મુખ્ય સદર !! ૦૩૫ - ટેક્ષીસ ઓન ઈમ્યુવેબલ પ્રોપર્ટી અધર ધેન એગ્રીકલ્ચર લેન્ડ!! અને ગૌણ સદર !! નોન એગ્રીકલ્ચરલ કન્વર્ઝન ટેક્ષ!!

(૧) માપણી ફી રૂ. ૨૨૬૦૦/- ચલન નં. ૮૦૫ તા. ૧૫/૦૫/૨૦૦૨ થી રૂ. ૧૮૨૦૦/- તથા ચલન નં. ૮૧૧ થી રૂ. ૪૪૦૦/- તથા રસ્તા અનામત ફી રૂ. ૧૦૦૦/- ચલન નં. ૭૨, તા. ૦૫/૦૬/૨૦૦૨ ના રોજ ભરપાઈ કરી ઉપર મુજબના ચલનો રજુ કરેલ છે.

શરતો :-

(૧) સ.ઈ. તાલુકા પંચાયત પારડી તાલુકો પારડી તા:૨૮/૦૨/૨૦૦૨ ના રોજ ખાત્રી કરેલ નકશામાં લાલ લીટી થી બતાવ્યા મુજબ ૬૧૯૯૩-૦૦ ચોરસ મીટરના ખેતી સિવાયના પ્લોટમાં ગુલાબી કલરથી બતાવેલ ૪૩૧૨-૦૦ ચો. મીટરથી વધુ જમીનમાં બાંધકામ કરવું નહી તેમજ બાકીની તમામ જમીન આંકાશ તરફ ખુલ્લી રાખવી.

(૨) જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અગાઉથી પરવાનગી મેળવ્યા સિવાય મંજૂર ખેતી સિવાયના પ્લોટમાં કોઈપણ જાતનો વધારો અગર બીજો ફેરફાર કરવો નહી તેમજ વધારાનું બાંધકામ કરવું નહી.

(૩) લેન્ડ રવન્યુ કોડની કલમ - ૪૮ હેઠળ જીલ્લા વિકાસ અધિકારીશ્રીની અગાઉથી લેખિત પરવાનગીની મેળવ્યા સિવાય મંજૂર જમીનનો બાંધકામનો રહેઠાણ મકાન સિવાયના હેતુઓ માટે ઉપયોગ કરવા સારું મનાઈ કરમાવવામાં આવે છે.

(૪) આ હુકમ થયાની તારીખથી છ માસમાં ખેતી સિવાયનું કૃત્ય શરૂ કરવું પડશે. અને જો તેમ કરવામાં તેઓ કસુર થશે તો જે તે તારીખથી ખેતી સિવાયની પરવાનગી આપવામાં આવે તે તારીખથી વિશેષધારો તથા દંડ જે કંઈ નક્કી થશે તે ભરવું પડશે.

(૫) કબજેદારે ખેતી સિવાયનું કૃત્ય શરૂ કર્યાની તારીખથી એક માસમાં ગ્રામ પંચાયત અધિકારી મારફતે કૃત્ય શરૂ કર્યાની લેખિત ખબર તાલુકા વિકાસ અધિકારીશ્રીને આપવી પડશે. જો તેમ કરવામાં તેઓ કસુર કરશે તો ખેતી સિવાયનો ધારો ઉપરાંત દંડ ભરવાને પાત્ર રહેશે.

(૬) મંજૂર કરેલ બિલ્ડીંગ પ્લાનમાં જણાવ્યા મુજબ જ બાંધકામ કરવું પડશે તથા અત્રેથી મંજૂર કરેલ પ્લાન ઉપર ગ્રામ પંચાયતનો સિક્કો કરાવવો પડશે.

(૭) બાંધકામ શરૂ કરતા પહેલા સંબંધિત નગર પંચાયત/ગ્રામ પંચાયત ધારા મુજબની પરવાનગી લેવાની રહેશે.

(૮) સરકારશ્રીના મહેસુલ વિભાગના ઠરાવ નંબર: /૧૦૬૫/૨૭૩૩/ખ, તા. ૧-૩-૬૭ ના રેખા નિયંત્રણના નિયમોને આધિન રહીને બાંધકામ કરવાનું રહેશે.

(૯) સરકારશ્રીના વૃક્ષારોપણના ધનિષ્ટ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગણામાં વૃક્ષો રોપી તેનું જતન કરવાનું રહેશે.

(૧૦) કબજેદારે પોતાના ખર્ચે ખાતા મારફતે ખેતી સિવાયના પ્લોટની માપણી કરાવવી પડશે. સર્વે ખાતા તરફથી માપણી મુજબ ક્ષેત્રફળ, આકારમાં કોઈ ફેરફાર પડશે તે મુજબ આ હુકમ તથા કરી આપવાનું સનદ ફેરફારને પાત્ર રહેશે.

(૧૧) કબજેદારે ખેતી સિવાયનું કૃત્ય કર્યાની તારીખથી પરંતુ અપીલ મુદત વીત્યા બાદ બે માસની મુદતમ નમુના - એમ માં હુકમમાં જણાવેલ તમામ શરતો સહીતની સનદ કરી આપવી પડશે અને પરવાગ સનદમાં જણાવેલ શરતોને આધિન રહેશે.

(૧૨) ખાળકુવા નિયમીત સાફ-કરવા ગોઠવણ ન હોય તો બાંધવી નહીં.

(૧૩) મંજૂર કરેલ ખેતી સિવાયના પ્લોટની જમીનની આજુબાજુના કમ્પાઉન્ડમાં ફરતે દિવાલ બાંધવા પ્રસંગ ઉપસ્થિત થાય તો તે સાડાત્રણ ફુટથી વધુ ઉચાઈની બાંધવી નહીં. રસ્તા તરફની બાજુએ જો દિવાલ બાંધવી હોય તો જીલ્લા વિકાસ અધિકારીશ્રીની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય બાંધકામ નહીં.

(૧૪) ખાળકુવા અને ખાળકોઠીનો ઉપયોગ મળસંગ્રહ માટે કરવો નહીં.

(૧૫) મુંબઈ ગણોત અને ખેતીની જમીનના કાયદાની તેમજ પ્રોટેક્શન એક્ટની જોગવાઈઓને આધાર આ પરવાનગી આપવામાં આવે છે.

(૧૬) બાંધકામમાં સહેલાઈથી બળી જાય તેવો સ્ફોટક પદાર્થ/સાધનોનો ઉપયોગ કરવો નહીં.

(૧૭) આ હુકમથી ત્રણ વર્ષમાં બાંધકામ પુરું કરવું પડશે. અને બાંધકામ પુરું થયેથી એક માસની અંતરની જાણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને કરવાની રહેશે.

(૧૮) ખીનખેતીના આકાર અંગે સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, હુકમો, નિયમો, પરિપત્ર સુચનાઓ બંધનકર્તા રહેશે.

(૧૯) એન.એ.કરવામાં આવેલી જમીનના સર્વે નંબર ઉપર બાંધકામ કરતા પહેલા સરકાર માન્ય રે પાસે સોઈલ ટેસ્ટ ફરજિયાત કરાવવાનું રહેશે અને આ સોઈલ ટેસ્ટની નકલ બાંધકામના રેકર્ડ રાખવાની રહેશે. એટલું જ નહીં પરંતુ સોઈલ ટેસ્ટ કરાવ્યા બદલની પ્રમાણિત નકલ બાંધકામ, જમીન મંજૂરી, બાંધકામની મંજૂરી સાથે સંકળાયેલ તમામ સરકારી, અર્ધસરકારી એજન્સીઓને ફરજિયાત આપવાની રહેશે. અને આ પ્રમાણપત્ર અને મંજૂરીની નકલ મકાન ખાતેદાર વ્યક્તિને બાંધકામ ક વ્યક્તિને પૂરું પાડ્યા બદલનો દાખલો પણ રેકર્ડ ઉપર રાખવાનો રહેશે.

(૨૦) બાંધકામ માટે લોડબેરીંગ અને બાંધકામની નિયત મર્યાદા અને પીલર્સ વગેરે માટે સરકાર અને જે તે સત્તા અધિકારી પાસે રજીસ્ટર કરવામાં આવેલ અથવા રજીસ્ટર થનાર માન્ય રે

એજન્સીયર પાસે જ ટ્રકચર ડિઝાઇન વગેરે કરાવવાનું રહેશે. અને આ સ્ટકચર, એજન્સીયર દ્વારા જે લેખિતમાં અભિપ્રાય આપવામાં આવે અથવા બાંધકામના નકશાઓની ભલામણ કરવામાં આવે તે બાંધકામના નકશાઓની પ્રમાણિત નકલો તમામ સંબંધિત સરકારી અર્થ સરકારી એજન્સીઓને પુરી પાડવાની રહેશે. અને આ નકશાઓ બાંધકામ ખરીદનાર મકાન માલિકોને પણ વિનામુલ્યે બાંધકામ કરનાર એજન્સીઓ ફરજિયાત પણે પુરા પાડવાના રહેશે.

(૨૧) ભારત સરકારશ્રીના નેશનલ બીલ્ડિંગ કોડ અનુસાર લાગુ પડતી શહેરી સત્તા મંડળ દ્વારા બાંધકામ માટેના જે કોઈ ધારાધોરણ અને નિયત નિયમો બાંધકામ માટેના નકકી કરે તે ધારા ધોરણ માટેની એજન્સી પાસેથી મંજૂરી મેળવ્યા પછી જ બાંધકામ હાથ ધરી શકશે તે શરતે આ બીનખેતીની મંજૂરી આપવામાં આવે છે. આવું બાંધકામ કોઈપણ પ્રકારની મંજૂરી વિના શરૂ ન થાય તે જોવાની જવાબદારી બીનખેતીની મંજૂરી કરાવનાર જમીન ધારકની રહેશે.

(૨૨) ઉપરોક્ત બીનખેતી થનાર જમીન પર જે કંઈ બાંધકામ કરવામાં આવે તે બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ વિગતો તમામ સંબંધિત સરકારી બીનસરકારી એજન્સીઓએ બાંધકામ ખાતેદાર વ્યક્તિએ પુરી પાડવાની રહેશે. અને મકાન ખરીદનાર તમામ મકાન ધારકોને પણ આ બાંધકામ કંઈ વ્યક્તિએ અથવા કોન્ટ્રાક્ટરે હાથ ધરેલ છે. તેના નામ, સરનામા સાથેની સંપૂર્ણ વિગતો પણ પ્રમાણિત નકલ સાથે પુરી પાડવાની રહેશે. સરકારશ્રી ની જુદી જુદી એજન્સીઓ દ્વારા બાંધકામ રજીસ્ટ્રેશન અને કોન્ટ્રાક્ટરના રજી. માટે જે કંઈ ધોરણો, સુચનાઓ બહાર પાડવામાં આવે તે પ્રમાણે બીલ્ડરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી તમામ સંબંધિતોને તેની લેખિતમાં જાણ કરવાની રહેશે.

(૨૩) તાજેતરમાં રાજ્ય સરકારશ્રી દ્વારા ગાંધીનગર સહીત તમામ સત્તા મંડળ અને નગરપાલિકાઓમાં બાંધકામ અંગેના નવા પ્લાનને મંજૂરી આપવા સામે પ્રતિબંધ મુકવામાં આવેલ જે ઉઠાવી લઈ તા: ૨૭/૦૩/૨૦૦૫ તથા તા: ૨૮/૦૫/૨૦૦૫ ના ઠરાવથી જે ધોરણ નકકી થયેલ છે તે પ્રમાણે બાંધકામની કાર્યવાહી કરવાની રહેશે. આ મંજૂરીના હુકમની નકલ લાગુ પડતા તમામ શહેરી સત્તા મંડળ, પંચાયતો, અને બીજા સંબંધિત સરકારી-એજન્સીઓને મોકલવામાં આવેલ છે. બીનખેતી થઈ રહેલ જમીન ઉપર બાંધકામ અંગેની કોઈપણ પ્રક્રિયા હાથ ન ધરાય તથા બાંધકામ અંગેની પ્રક્રિયા સંબંધિત એજન્સીની મંજૂરી પછી જ હાથ ધરાય તે જોવાની જવાબદારી જે તે ગ્રામ/તાલુકા પંચાયતની રહેશે.

જો ભુતકાળમાં આ જમીન ઉપરના પ્લાન મંજૂર થઈ ગયેલ હોય તો કોઈ વિશેષ મંજૂરી લેવાની રહે છે કે કેમ? તે જમીન ધારક, સંબંધિત એજન્સી પાસેથી ખાતરી કર્યા પછી જ બાંધકામ કરવાનું રહેશે.

(૨૪) ભુકંપપ્રુફ મકાનોની ડિઝાઇનનો જ ઉપયોગ થાય તે માણ જોવાની સુચના આપવામાં આવે છે.

(૨૫) નાયબ નગર નિયોજકશ્રી વલસાડે તેમનો તા: ૨૦/૧૨/૨૦૦૫ ના પત્ર નં. બી.પી./ચલા./પારડી/૨૦૦૨ / થી જાણાવેલ નીચે મુજબની શરતોનું પાલન કરવાનું રહેશે.

(૧) નકશામાં દર્શાવ્યા મુજબના માપો તથા માર્જીનો રચણે જાળવવાનાં રહેશે.

(૨) નકશામાં દર્શાવ્યા સિવાયનું વધારાનું બાંધકામ કરતાં પહેલાં તેના નકશા મંજૂર કરવાનાં રહેશે.

(૩) પ્રાથમિક સુવિધાઓ જેવી કે ગટર લાઈન, ખાણકુવો, લીજળી વરસાદી પાણીનો નિકાલ માટે વિગેરે સુવિધાઓ અરજદારશ્રીએ પુરી પાડવાની રહેશે.

(૪) સહિયાની કોમન પ્લોટ અને રસ્તાની જમીન સહિયારી માલિકીની સંયુક્ત પ્લોટ હોલ્ડરની સહિયારી માલિકીની ગણાશે. અને તે ઉપર મુળ માલિકનો કોઈ હક રહેશે નહીં.

(૫) બાંધકામના નિયમો સહ જોગવાઈ પ્રમાણે ઉપયોગ માટે નિયત મુજબના હેતુ માટે કોમન પ્લોટના ૧/૬ ભાગના ક્ષેત્રફળમાં બાંધકામ કરવા પ્લોટ હોલ્ડરો ઇચ્છે તો મંજૂરી મેળવી તેમ કરી શકશે. અન્ય બીજા કોઈ હેતુ માટે બાંધકામ કરી શકશે નહીં.

(૬) કોમન પ્લોટ અને રસ્તાની જમીન હરાજથી બક્ષીશથી કે અન્ય કોઈ પણ રીતે વેચાણ કે તબદીલ થઈ શકશે નહીં.

(૭) લે. આઉટ પ્લાનમાં આયોજન કરેલ આંતરિક રસ્તાની જમીન હંમેશાને માટે ખુલ્લી રાખવાની રહેશે. તેમજ હરાજથી બક્ષીશથી કે અન્ય કોઈપણ રીતે વેચાણ કે તબદીલ થઈ શકશે નહીં.

(૮) સવાલવાળી જમીન બાબતે સ્થાનિક સંસ્થાની મંજૂરી મુજબી લેવાની રહેશે.
 (૯) સવાલવાળી જમીનના રહેઠાણ(સબ પ્લોટીંગ)ના હેતુ માટે લે. આઉટમાં ભોંયતળિયે સુચવેલ ૧ (એક) યુનિટ માટેનું ૩૮-૫૦ ચો.મી. બાંધકામ પ્રમાણે કુલ ૧૧૨ સબ પ્લોટ માટેના કુલ ૧૧૨ (યુનિટ) માટેનું ૪૩૫૨-૦૦ ચો.મી. બાંધકામ ક્ષેત્રફળ પુરતી વિકાસ પરવાનગી આપવા માટે જ ભલામણ કરવામાં આવેલ છે.

(૧૦) કોમન પ્લોટમાં બાંધકામ થઈ શકશે નહિ.

(૧૧) એમોચ રોડ માટે અલગ પરવાનગી લેવાની રહેશે.

(૧૨) જે બાંધકામ માટે પરવાનગી આપવામાં આવેલ છે તે સિવાય અન્ય કોઈ બાંધકામ કરી શકાશે નહીં.

(૧૩) સરકારશ્રીના જમીન પટ્ટી વિકાસ નિયમો વિરુદ્ધ બાંધકામ કરવામાં આવશે તો અરજદાર પોતે જવાબદાર થશે.

(૧૪) સરકારશ્રીના તા:૨૭/૦૩/૦૧ ના કરવાની જોગવાઈ તથા શરતોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

(૧૫) ગંદા તથા આકાશી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.

(૧૬) નહેરમાં ગયેલ જમીનથી નિયમ મુજબ માર્જન જાળવવાનું રહેશે.

(૨૬) સરકારશ્રીના તા:૨૭/૦૩/૦૧ તથા તા:૨૮/૦૫/૦૧ ના ઠરાવમાં જણાવ્યાં મુજબ તથા સોઈલ ટેસ્ટ રીપોર્ટને ધ્યાને લેતા બાંધકામ શરૂ થાય ત્યારે પ્રોગ્રેસ રીપોર્ટ સ્ટેપ બાઈ સ્ટેપ ફોર્મ નં. ૬(એ), ૬(બી), ૬(સી) ૬(ડી) માં બીનચૂક રજૂ કરવાનો રહેશે. કામ પૂર્ણ થતાં કંપલીશન રીપોર્ટ ફોર્મ નં. ૭, ૮, ૯, ૧૦ અને ૧૧ માં અવશ્ય રજૂ કરવાનો રહેશે. અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

(૨૭) ઉપરની કોઈપણ શરતોનો ભંગ થશે તો આ પરવાનગી પુરેપુરી અથવા પરવાનગીનો અમુક ભાગ રદ કરવાને પાત્ર થશે. નજીકના પ્લોટના બાંધકામ માટેના સમય સીમમાં આ પરવાનગી રદ કરવામાં આવશે.

(૨૮) તા:૩૦/૦૫/૨૦૦૨ ના કબુલાત નામમાં જણાવ્યાનુસાર પીવાના પાણીની સગવડ / ચોમાસાના પાણીના નિકાલની સગવડ / ગંદા પાણી / ઘરવપરાશના પાણીના નિકાલ / જમીનને જોડતા પાંકા રસ્તા તથા આંતરિક રસ્તાની સગવડ કરવાની રહેશે.

(૨૯) શિક્ષાત્મક કલમો:

(અ) અરજદાર ઉપરોક્ત કોઈપણ શરતોનો ભંગ કરે તો જિલ્લા વિકાસ અધિકારીશ્રી સદરહુ કાયદાથી ઠરાવો અન્વયે અરજદાર કે કોઈપણ બીજી શિક્ષાને પાત્ર હોય તો તેને બાંધ આવ્યા સિવાય તેને કરમાવવું યોગ્ય લાગે તો તે પ્રમાણે દંડ અથવા આકાર લઈ સદરહુ જમીનનો કબજો અરજદાર પાસે ચાલુ રહેવા દઈ શકશે.

(બ) ઉપરની પેટા કલમ -અ માં ગમે તે મજકુર હોય તો તે છતાં પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સદરહુ પરવાનગી વિરુદ્ધ થયેલ અથવા વપરાતા કોઈપણ મંકાત અથવા ઈમલાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આ અર્થે જે મુદત ઠરાવી હોય તે મુદત દરમ્યાન ખસેડવા અથવા તેમાં ફેરફાર કરવા નું ફરમાવે તો તે કાયદેસર ગણાશે. અને ઠરાવેલી મુદત દરમ્યાન કેવી રીતે ખસેડવા અથવા તેમાં ફેરફાર કરવામાં ન આવે તો જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમ કરવાની અને તેમ કરવામાં જે ખર્ચ થાય તે અરજદાર પાસેથી જમીન મહેસુલની બાકી તરીકે વસુલ કરવાને મુખત્યાર છે.

ગામનું નામ સર્વે નં/બ્લોક નં. બિનખેતી વિસ્તાર વિશેષધારાની રૂપાંતર કરની
 ચો. મી. રકમ રૂ. રકમ રૂ.

ચલા

૨૮૧/૧/૨

૬૧૯૯૩-૦૦

૩૭૧૯-૬૦

૩૭૧૯૬-૦૦

સહી:- એમ. શાહિદ

જિલ્લા વિકાસ અધિકારી

જિલ્લા પંચાયત વલસાડ,

પ્રતિ,

શ્રી કમળજી લલ્લુભાઈ દેસાઈ રહે. વાપી હમણસોડ તા. પારડી જી. વલસાડ
રો- મંજુર કરેલ નકશો સામેલ છે.

નકલ કામના કાગળો સહ રવાના:

આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી, પારડી.

રો- તાલુકા નમુના નમુના નં રો અને જમાં નોંધ કરવા સારુ તથા વિશેષવારો નકલો વચ્ચેલ તે મુજબ
ઉપજાવતક તૈયાર કરી વસુલાત કરવા સારુ

નકલ રવાના:-

ડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર, લોન્ડ રેકર્ડ્ઝ, વલસાડ મુ. જલ્લાલપોર તરફ

નકશા, હુકમ તથા માપણીની ના મૂળ ચલન નં. ર૩૭ તા. ૧૭/૦૪/૨૦૦૨ ની નકલ સાથે માપણી કરવા
સારુ

નકલ જય ભારત સહ રવાના:-

(૧) કલેક્ટરશ્રી વલસાડ તરફ.

(૨) ડેપુટી કમિશનરશ્રી. કલેક્ટર કચેરી, ગાંધી માર્ગ, એ બ્લોક જલારામ રોડ, વલસાડ.

(૩) સમ્પત્તી, ગુજરાત પ્રોવિડન્ટ ફંડ બોર્ડ, સેક્ટર નં ૫૦/એ ગાંધીનગર તરફ.


નકલ રવાના:

તલાલી હમ મંજી ચલા તા. પારડી

જી. વલસાડ તરફ મુળ કામના કાગળો સાથે.

રો આ સાથે મુળ પ્રકરણ સામેલ છે જે મુજબ ગામના નમુના નં ર, જ, દ અને ૭/૧૨ તથા ટાંગા અને
ટાંગા માં નોંધ કરી તેના આધારે સહ અત્રે જાણ કરવા સારુ.

રવાના કર્યું


જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા પંચાયત વલસાડવતી.